https://archive.org/details/bk1383/page/n0/mode/1up

1996-04-27 -Mumbai Sanatan Samaj to Laxminarayan Dharm Prachar Samiti -against Bhoomi Dah (1383)

All Items on https://archive.org/details/realpatidar
realpatidar.com
Full Library on https://realpatidar.com/library

મુંબઇ સનાતન સમાજ,
મુંબઈ. ૪૦૦૦
સભાસ્થળ: પાટીદારવાડી ઘાટકો
ઘાટકોપર તા. ૨૭-૪-૯૬

શ્રી પ્રમુખશ્રી,
શ્રી [લક્ષ્મી]નારાયણ સનાતન ધર્મ પ્રચાર સમિતિ,
(ઉમિયા માતાજી), વાંઢાય (દેશલપર)
કચ્છ.

માનનીય પ્રમુખશ્રી,

વિષય: પીરાણા સતપંથના ગાદીપતિ શ્રી કરસન કાકાની જમીનદાહની યોગ્યતા માટેની 'કચ્છમિત્ર', પાટીદાર સંદેશ તથા પાટીદાર સૌરભમાં છપાયેલ જાહેરાત બાબત.

સવિનય જણાવવાનું જે આજ રોજે તા. ૨૭-૪-૯૬ના ઘાટકોપર પાટીદારવાડી મધ્યે એક સભા બોલાવવામાં આવેલ જેમાં મુંબઈ મધ્યે સતપંથ ધર્મનું જે સંમેલન ભારત ભરના વિદ્વાન સાધુ સંતોના નેજા હેઠળ તા. ૩૦-૩૧ ડીસેમ્બર ૧૯૯૫ના રોજ ઘાટકોપર મધ્યે મળેલ ત્યારે આપણા સનાતની ભાઈઓએ શ્રી કરસનદાસ કાકા સાથે ચર્ચા વિચારણા કરતાં આગ્રહ રાખેલ કે તેઓ સતપંથ ધર્મમાં જે મુસલમાન જમીનદાહ આપવામાં આવે છે તે નાબુદ કરતાં અગ્નિ સંસ્કાર આપવામાં આવે તે અનિવાર્ય છે. અને તે માટે તેઓએ જાહેર મંચ પરથી આ માટે આદેશ આપવો. પણ તેઓ આ માટે સંમત થવામાં આનાકાની કરતાં સનાતની ભાઈઓએ એક જાહેર નિવેદન સંતોને સંબોધતા જાહેર કરેલ અને મોટા ભાગના સંતોને આ નિવેદન આપવામાં આવેલ. આ ઉપરાંત ઘણા સંતોને સનાતની ભાઈઓ રૂબરૂમાં મળેલ. અને તેમને અંતિમ સંસ્કાર જે જમીનદાહ સતપંથ ધર્મમાં કરવામાં આવે છે તે બાબત જાણ કરેલ. હતી. તેઓએ પણ આ પ્રથા નાબુદ કરવા બાબતમાં મદદ કરવા આશ્વાસન આપેલ.

આ નિવેદનને ધ્યાનમાં લેતાં શ્રી કરસન કાકાએ અથર્વવેદનો આશરો લઈ જમીનદાહ વેદોક્ત છે એવું પ્રતિપાદન કરતાં 'પાટીદાર સંદેશ', પાટીદાર સૌરભ તેમજ 'કચ્છમિત્ર'માં જાહેરખબર આપતાં નિવેદનો છપાવેલ છે, જે આપણા સનાતન સમાજના ભાઈ બહેનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન છે. આ જાહેરાતથી સનાતન સમાજનો જ નહિ હિન્દુ ધર્મ તેમજ વેદોને આહ્વાન આપવામાં આવેલ છે. આ બાબત ધ્યાનમાં લઈ ગાંધીધામ આર્ય સમાજે ...

realpatidar.com

https://archive.org/details/bk1383/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

Real Patidar
Unravel Truth

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

Use the Bookmarks facility in the PDF to directly go to the pages containing Highlights.

For Reference See Pages: 1, 2.
For page numbers, see the page footer. Page numbers are in 'Page x of y' format

References by: RealPatidar.com - Created using: step2-QR-and-3-RM-v5.py

https://archive.org/details/bk1383/page/n2/mode/1up

Real Patidar Unravel Truth

Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN, o=realpatidar.com, email=mail@realpatidar.com
Reason: I have reviewed this document
Date: 2026.02.16 18:25:48 +05'30'

1996-04-27 -Mumbai Sanatan Samaj Letter to Laxminarayan Dharm Prachar Samiti - Deshalpar Vandhay on BhoomiDah Advertisement in Kutch Mitra by Karsan Kaka of Pirana Satpanth #History

મુંબઇ સનાતન સમાજ,
મુંબઈ. ૪૦૦૦..
સભાસ્થળ: પાટીદારવાડી ઘાટકો(પર)

ઘાટકોપર તા. ૨૭-૪-૯૬

શ્રી પ્રમુખશ્રી,
લક્ષ્મીનારાયણ સનાતન ધર્મ પ્રચાર સમિતિ,
(નિયા માતાજી), વાંઢાય (દેશલપર)
કચ્છ.

માનનીય પ્રમુખશ્રી,

વિષય: પીરાણા સતપંથના ગાદીપતિ શ્રી કરસન કાકાની જમીનદાહની યોગ્યતા માટેની 'કચ્છમિત્ર', પાટીદાર સંદેશ તથા પાટીદાર સૌરભમાં છપાયેલ જાહેરાત બાબત.

1995-12-31 -Satpanth Dharm Sadhu Sammelan at Ghatkopar

સવિનય જણાવવાનું જે આજ રોજે તા. ૨૭-૪-૯૬ના ઘાટકોપર પાટીદારવાડી મધ્યે એક સભા બોલાવવામાં આવેલ જેમાં મુંબઈ મધ્યે સતપંથ ધર્મનું ? સંમેલન ભારત ભરના વિદ્વાન સાધુ સંતોના નેજા હેઠળ તા. ૩૦-૩૧ ડીસેમ્બર ૧૯૯૫ના રોજ ઘાટકોપર મધ્યે મળેલ ત્યારે આપણા સનાતની ભાઈઓએ શ્રી કરસનદાસ કાકા સાથે ચર્ચા વિચારણા કરતાં આગ્રહ રાખેલ કે તેઓ સતપંથ ધર્મમાં જે મુસલમાન જમીનદાહ આપવામાં આવે છે તે નાબુદ કરતાં અગ્નિ સંસ્કાર આપવામાં આવે તે અનિવાર્ય છે. અને તે માટે તેઓએ જાહેર મંચ પરથી આ માટે આદેશ આપવો. પણ તેઓ આ માટે સંમત થવામાં આનાકાની કરતાં સનાતની ભાઈઓએ એક જાહેર નિવેદન સંતોને સંબોધતા જાહેર કરેલ અને મોટા ભાગના સંતોને આ નિવેદન આપવામાં આવેલ. આ ઉપરાંત ઘણા સંતોને [illegible]ી ભાઈઓ રૂબરૂમાં મળેલ અને તેમને અંતિમ સંસ્કાર જે [illegible] સતપંથ ધર્મમાં [illegible] દફનાવવામાં આવે છે તે બાબત જાણ કરેલ. [illegible]ગોએ પણ આ પ્રથા નાબુદ કરવા બાબતમાં મદદ કરવા આશ્વાસન આપેલ.

Misguiding Advertisment in Patidar Sandesh, Patidar Saurabh and Kutch Mitra about Bhoomidah #History

આ નિવેદનને ધ્યાનમાં લેતાં શ્રી કરસન કાકાએ અથર્વવેદનો આસરો લઈ જમીનદાહ વેદોક્ત છે એવું પ્રતિપાદન કરતાં 'પાટીદાર સંદેશ', પાટીદાર સૌરભ તેમજ 'કચ્છમિત્ર'માં જાહેરખબર આપતાં નિવેદનો છપાવેલ છે, જે આપણા સનાતન સમાજના ભાઈ બહેનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન છે. આ જાહેરાતથી સનાતન સમાજનો જ નહિ હિન્દુ ધર્મ તેમજ વેદોને આહ્વાન આપવામાં આવેલ છે. આ બાબત ધ્યાનમાં લઈ ગાંધીધામ ખાતે રામદેવ [illegible]

realpatidar.com

realpatidar.com

Arya Samaj of Gandhidham objected and protested against misguiding advertisement of Satpanthis

કરાવવાનું જાહેર નિવેદન કચ્છ મિત્રમાં આપી અતી આવકાર્ય કાર્ય કરેલ છે તે આપણા સૌના ધન્યવાદને પાત્ર છે. આ બાદ શ્રી કરશન કાકાએ શાસ્ત્રાર્થ કરવા ગાંધીધામ આર્યસમાજને આહ્વાન આપેલ છે. તેના તેઓએ સ્વીકાર કરેલ છે. તેઓ શ્રી કરશન કાકા પાસેથી સમય નક્કી વિદ્વાનો સાથે રાખી શાસ્ત્રાર્થ કરવાના છે.

ઉપરોક્ત પરિસ્થિતિને ધ્યાનમાં લઈ આજની સભામાં ઠરાવવામાં આવેલ છે કે ગાંધીધામ આર્ય સમાજે જે શ્રી કરશન કાકા સાથે શાસ્ત્રાર્થ કરવાના આહ્વાનને સમંતિ આપેલ છે તે માટે અમારો સૌનો તેમને હાર્દિક સહકાર છે. સાથ છે. આ બાબતે અમે સૌ તેમની સાથે જ છીએ. આપ પણ આ બાબત સમંત થતાં સહકાર જાહેર કરશો એવી નમ્ર વિનંતી.

આ ઉપરાંત મુંબઈ મધ્યે જે સતપંથીઓનું ધર્મ સંમેલન યોજાએલ ત્યારે સતપંથ ધર્મના પ્રચાર્થે જે સાહિત્ય, આધર્વેદ, પ્રાર્થનાઓ તેમજ નિત્ય આચરણ પોથી વગેરે પ્રસિદ્ધ કરેલ છે તે આપણી ભાવિ પેઢીને ખુબ જ ગંભીર રીતે હાની કરતાં છે. આપણે સૌ એ તેનો અભ્યાસ કરી જાહેર સભામાં આ વિષે ગંભીર ચર્ચા વિચારણા કરવાની [illegible] તાતી જરૂર છે. અમારી ખાસ વિનંતી છે કે અતી નજીકના ભવિષ્યમાં સમસ્ત ભારત ભરમાં વસતા તેમજ સ્થાનિક ભાઈઓ સહિતની એક જાહેર સભા બોલાવવી અનિવાર્ય છે. અને આપ જરૂર સભા બોલાવશો. આ મુંબઈના સનાતની ભાઈઓની માગણી છે. તેની નોંધ લેશો.

શ્રી લક્ષ્મીનારાયણ સનાતન ધર્મ પ્રચાર સમિતિ પણ શ્રી કરશન કાકાના જાહેર નિવેદનને પડકારશે જ. એ આપણી ફરજ છે. જરૂરીઆત છે. આ માટે પૂ. હરિદાસજી મહારાજે કચ્છ મિત્રમાં જે જાહેર ટેકો ગાંધીધામ આર્ય સમાજને જાહેર કરેલ છે તે ધન્યવાદને પાત્ર છે. અને આ પ્રવૃતિનો બળ, સાથ સહકાર આપનાર છે.

વર્તમાને શ્રી કરશન કાકાની જે સતપંથ ધર્મ સંમેલન (મુંબઈ તેમજ કાદીઆમાં) આયોજવામાં આવેલ છે તે આપણી સમસ્ત નાતને ગુમરાહ કરવા પુરતું છે. આપણી જાગૃતિ જ સનાતન ધર્મનું રક્ષણ કરી શકશે તે આપ સમજી શકો છો.

આપણા અખીલ ભારત કચ્છ કડવા પાટીદાર સમાજના ગત સંમેલનોમાં જે ૧૯મી કલમ થી જે અંતિમ સંસ્કાર,

realpatidar.com

https://archive.org/details/bk1383/page/n4/mode/1up

realpatidar.com

અગ્નિ સંસ્કાર જ કરવો અનીવાર્ય ઠરાવવામાં આવેલ છે. જે સામાન્ય રીતે વર્ષોથી અને આદીકાળથી આપણો સામાજીક રિવાજ છે તેની વિરૂધ્ધમાં શ્રી કરશન કાકાની હાલની પ્રવૃતિ છે. આ માટે સમાજે તેમજ ધર્મ સમિતિએ સાથે મળી ત્વરિત ઘટતું ~~કર~~ કરવું જ જોઈએ.

અમારી આપને હાર્દિક વિનંતી છે કે ઉપરોક્ત બાબત આપ ઘટતું કરી આભારી કરશો.

એજ લી.

1) રતનશી મુળજી વાસાણી.
2) લખમશી લધાભાઈ વાસાણી
3) એલ. વી. પટેલ.
4) દીનજી શીવગણ રૂડાણી
5) નારણ ભગવાન [illegible]
6) [illegible] શીવદાસ માવાણી
7) [illegible] હીરજી પટેલ
8) શામજી દેવજી પટેલ
9) મનજી [illegible] પટેલ
10) રામજી. ગંગાદાસ પોકાર
11) કાનજીભાઈ એસ. પટેલ
12) [illegible] [illegible] [illegible]
13 કરસન ભાઈ ભગત
14 મેઘજી [illegible] પટેલ
15 ઉમરશીભાઈ હરજી પટેલ.
16 હેમંત. રતનશી ભીમાણી
17 [illegible] કરશનજી
18 [illegible] [illegible] પટેલ
19 મોહનજી [illegible]
20 [illegible] હીરાભાઈ પટેલ
21 [illegible]

નકલ: 1) શ્રી અખીલ ~~[illegible]~~ ભારત કચ્છ કડવા પાટીદાર સમાજ - ભાયખલા.
2) ગાંધીધામ આર્ય સમાજ - ગાંધીધામ.

realpatidar.com